

રાજકોટ મહાનગરપાલિકા

ડો.આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ - ૩૬૦ ૦૦૧

-: અખબારી યાદી :-

રાજકોટ માટે પીવાના પાણી માટેના નવા સોર્સ ઉભા કરવાની દિશામાં પ્રયાસ : મ્યુનિ. કમિશનર શ્રી અમિત અરોરાએ ન્યારી-૨ ડેમની વિઝિટ કરી:

ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને આર.ઓ. ટ્રીટમેન્ટ પ્લાન્ટની મદદથી ન્યારી-૨ ડેમનું પાણી ભવિષ્યમાં પીવાના ઉપયોગ માટે લઈ શકાય કે કેમ તેની શક્યતા ચકાસવામાં આવશે

હાલમાં વોંકળાના પાણી ન્યારી-૨ ડેમમાં આવતા હોવાથી આ જળજથ્થો પીવાના ઉપયોગમાં લઈ શકાય એમ નથી: ભવિષ્યમાં વોંકળાઓને ભૂગર્ભ ગટર સાથે જોડી તેના પાણી ડેમમાં આવતા અટકાવવા અંગે વિચારણા

તા. ૨૪-૦૯-૨૦૨૧





દિવસે ને દિવસે વિકસી અને વિસ્તરી રહેલા રાજકોટ શહેરમાં ભવિષ્યની વસતિ માટેની પીવાના પાણીની સંભવિત જરૂરિયાતને નજર સમક્ષ રાખી અત્યારથી જ પીવાના પાણી માટેના નવા સોર્સ ઉભા કરવાની દિશામાં પ્રયાસના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર શ્રી અમિત અરોરાએ આજે તા.૨૪-૯-૨૦૨૧ના રોજ ન્યારી-૨ ડેમની મુલાકાત લીધી હતી.

આ સ્થળ મુલાકાત અંગે વાત કરતા મ્યુનિ. કમિશનરશ્રીએ એમ જણાવ્યું હતું કે, રાજકોટની પાણીની ભાવી જરૂરિયાતનો અત્યારથી જ વિચાર કરવો જરૂરી છે. મહાનગરપાલિકાએ પાણીના નવા સોર્સ ઉભા કરવા પણ જરૂરી બને છે. આ પ્રયાસના એક ભાગરૂપે આજે ન્યારી-૨ ડેમની મુલાકાત લીધી હતી. અત્યારે આ જળાશયમાં વૉકળાઓના પાણી પણ આવી રહ્યા હોવાથી ડેમનું પાણી પીવાના ઉપયોગમાં લઈ શકાય એમ નથી. ભવિષ્યની વાત કરીએ તો, હાલ જે વૉકળાઓમાંથી ડેમમાં પાણી આવે છે તે તમામ વૉકળાઓને ભૂગર્ભ ગટર સાથે જોડી દઈ તેના પાણીને ડેમમાં આવતા રોકવા અંગે ચર્ચા વિચારણા ચાલી રહી છે. આ યોજનાની વાસ્તવિક સંભાવનાઓ ચકાસવામાં આવી રહી છે.

કમિશનર શ્રી અમિત અરોરાએ વધુમાં ઉમેર્યું હતું કે, ન્યારી-૨ ડેમણા નીરને પ્રદૂષિત કરતા વૉકળાનાં પાણીને અન્યત્ર વાળવામાં આવે તો ડેમમાં ધીમે ધીમે ચોખ્ખું પાણી આવી શકે છે. આ માટે વરિષ્ઠ અધિકારીશ્રીઓ પાસેથી ફિઝીબિલીટી રીપોર્ટ માંગવામાં આવેલ છે. આ રીપોર્ટ રજુ થયે આગળની કઈ કાર્યવાહી કરી શકાય એમ છે તે નક્કી કરવામાં આવશે.

દરમ્યાન કમિશનરશ્રીએ ન્યારી-૨ ડેમના નીરને શુદ્ધ કરવા માટે ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને આર.ઓ. ટ્રીટમેન્ટ પ્લાન્ટનાં વિકલ્પ અને સંભાવનાઓ ચકાસવા માટે પણ અધિકારીશ્રીઓને સૂચના આપી હતી.

કમિશનરશ્રીની આ સ્થળ મુલાકાત દરમ્યાન નાયબ કમિશનરશ્રીઓ શ્રી આશિષ કુમાર, શ્રી ચેતન નંદાણી અને શ્રી એ.આર. સિંહ, સિટી એન્જિનિયરશ્રીઓ શ્રી એમ.આર.કામલિયા, શ્રી એચ.યુ.દોઢિયા, શ્રીકે.એસ.ગોહેલ, શ્રીવાયકે.ગૌસ્વામી, શ્રીએચ.એમ.કોટક, પી.એ.(ટુ) કમિશનર શ્રી રસિક રૈયાણી, ડેપ્યુટી એન્જિનિયરશ્રીઓ શ્રી કે.પી.દેથરીયા, શ્રી સી.બી. મોરી, શ્રી બી.ડી.ઢોલરિયા, શ્રી એચ.એન.શેઠ અને શ્રી એ.જી. પરમાર વગેરે હાજર રહયા હતાં.

(જન સંપર્ક અધિકારી)

રાજકોટ મહાનગરપાલિકા